

This Question Paper contains 20 printed pages.

(Part - A & Part - B)

Sl.No.

054 (G)

(FEBRUARY-MARCH, 2025)

(SCIENCE STREAM)

(CLASS - XII)

પ્રશ્ન પેપરનો સેટ નંબર જેની
સામેનું વર્તુળ OMR શીટમાં
ધૂંકરવાનું રહે છે.

Set No. of Question Paper,
circle against which is to be
darken in OMR sheet.

15

Part - A : Time : 1 Hour / Marks : 50

Part - B : Time : 2 Hours / Marks : 50

(Part - A)

Time : 1 Hour

/Maximum Marks : 50

સૂચનાઓ :

- 1) આ પ્રશ્નપત્રના ભાગ - A માં હેતુલક્ષી પ્રકારના કુલ 50 પ્રશ્નો છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
- 2) પ્રશ્નોની કમ સંખ્યા 1 થી 50 છે અને દરેક પ્રશ્નનો ગુણ 1 છે.
- 3) કાળજીપૂર્વક દરેક પ્રશ્નનો અભ્યાસ કરી સાચો વિકલ્પ પસંદ કરીને OMR શીટમાં જવાબ લખવો.
- 4) આપણે અલગથી આપેલ OMR પત્રકમાં જે તે પ્રશ્ન નંબર સાથે (A) O, (B) O, (C) O, (D) O આપેલા છે. તે પ્રશ્નનો જે જવાબ સાચો હોય તેના વિકલ્પ પરના વર્તુળને બોલપેનથી પૂર્ણ ● ધૂંકરવાનું રહેશે.
- 5) રુ કાર્ય હેતુ આ ટેસ્ટ બુકલેટમાં આપેલી જગ્યા પર કરવાનું રહેશે.
- 6) પ્રશ્નપત્રકમાં ઉપરની જમાણી બાજુમાં આપેલા પ્રશ્નપત્રક સેટ નં. ને OMR પત્રકમાં આપેલી જગ્યામાં લખવાનું રહેશે.
- 7) વિદ્યાર્થીઓ જરૂર જણાય ત્યાં સાદા કેલ્ઝ્યુલેટર અને લોગ ટેબલનો ઉપયોગ કરી શકશે.
- 8) આ પ્રશ્નપત્રમાં વપરાયેલ સંજ્ઞાઓને તેના યોગ્ય પ્રચલિત અર્થ છે.
- 9) આકૃતિવાળા/ચાર્ટ પ્રશ્નોમાં દરિલીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આપેલા છે. જેનું ખાસ ધ્યાન રાખવું, આ પ્રશ્નો ભાગ દરિલીન વિદ્યાર્થીઓ માટે જ છે.

-
- 1) ટેલિવિડનના સંદેશાવ્યવહાર તંત્રમાં કખા તરંગોનો ઉપયોગ થાય છે.

૨૬ કાર્ય

- (A) માઈક્રોવેવ
(B) પારસ્ક્રિટ તરંગો
(C) રેડિયો તરંગો
(D) પારસ્ક્રિટલી તરંગો

2) એક રેડિયો 7.5 MHz થી 12 MHz ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને Tune (સુમેળ) કરી શકે છે. આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે?

- (A) 30m થી 45m
- ~~(B)~~ 15m થી 30m
- (C) 25m થી 40m
- (D) 20m થી 35m

26
7.5*

3) પ્રકાશનું ડિરણ (n_2) વહીભવનાંકવાળા ઘણ માધ્યમમાંથી (n_1) વહીભવનાંકવાળા પાતળા માધ્યમમાં જાય ત્યારે, નીચેનામાંથી કયું સાચું છે. એ આપાતકોણ અને, r એ વહીભૂતકોણ છે.

- (A) $n_{21} > 1, r < i$
- ~~(B)~~ $n_{21} < 1, r < i$
- (C) $n_{21} > 1, r > i$
- (D) $n_{21} < 1, r > i$

4) એક નાના ટેલિસ્કોપના ઓપ્ટિક્ટીવની કેન્દ્રલંબાઈ 132 cm અને આઈપીસની કેન્દ્રલંબાઈ 6 cm છે. ટેલિસ્કોપની મોટવશક્તિ કેટલી?

- (A) 24
- (B) 32
- ~~(C)~~ 22
- (D) 20

$f_o =$
 $f_c =$

$m =$

$v =$

$d =$
 $D =$
 α_2

$\frac{d}{D}$
 λ

5) યંગના બે સ્લિટના પ્રથોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28mm અને પડતો 2.5m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને બીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2cm જેટલું માપવામાં આવે છે. પ્રથોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી?

- (A) 600 nm
- (B) 500 nm
- (C) 486 nm
- ~~(D)~~ 672 nm

6) પોલેરોઇડ પર અધ્યુવીભૂત પ્રકારીં આપાત કરતાં નિર્ગમન પામતા પ્રકારાની તિવ્રતા આપાત પ્રકારાની તિવ્રતા કરતાં _____.

26

OFJ

- (A) બમણી થાય.
(B) અડધી હોય છે.
(C) ચારગણી થાય.
(D) ચોથા ભાગની થાય.

7) નીચેનામાંથી કઈ ઘટના પ્રકારાના તરંગવાદ દ્વારા સમજવી શકતી નથી.

- (A) વ્યતિકરણ
(B) ધ્રુવીભવન
(C) વિવર્તન
(D) ફોટોઇલેક્ટ્રોક અસર

8) સિઝિયમનું કાર્ય વિધેય 2.14 eV છે. સિઝિયમની થ્રેસોલ (કટ ઓફ) આવૃત્તિ કેટલી થાય? [$h = 6.63 \times 10^{-34} \text{ Js}$]

- (A) $3.22 \times 10^{33} \text{ Hz}$
(B) $3.22 \times 10^{14} \text{ Hz}$
(C) $5.16 \times 10^{15} \text{ Hz}$
(D) $5.16 \times 10^{14} \text{ Hz}$

9) એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રોક કટ ઓફ વોલ્ટેજ $2V$ છે. ઉત્સર્જયેતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જા કેટલી હશે?

- (A) $2.4 \times 10^{-19} \text{ J}$
(B) $4 \times 10^{-19} \text{ J}$
(C) $3.2 \times 10^{-19} \text{ J}$
(D) $2 \times 10^{-19} \text{ J}$

70

f₆

10) નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય ત્યારે ધાતુમાં ફોટો ઇલેક્ટ્રોક અસર જોવા મળે.

- (A) આપાત ફોટોનની ઊર્જા ($h\nu$) એ ધાતુના વર્કફિન્ડન (ϕ_0) કરતાં ઓછી હોય.
- (B) આપાત પ્રકાશની તરંગલંબાઈ (λ) એ ધાતુની થ્રેસોલ્ડ તરંગલંબાઈ (λ_0) કરતાં મોટી હોય.
- (C) આપાત પ્રકાશની આવૃત્તિ (v) એ ધાતુની થ્રેસોલ્ડ આવૃત્તિ (v_0) કરતાં વધું હોય.
- (D) $\lambda > \frac{hc}{\phi_0}$

11) લેસર વહે 6×10^{14} Hz ની આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જયેલ પાવર 2×10^{-3} W છે. ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? [$h = 6.63 \times 10^{-34}$ Js]

- (A) 3.98×10^{19}
- (B) 1.99×10^{15}
- (C) 3×10^{15}
- (D) 5×10^{15}

12) ગેર્ગર-માર્સ્ટનના પ્રયોગમાં પાતળા સુલાર્ણ વરખ પર આપાત α -કણોમાંથી લગભગ કેટલા ટકા α -કણોનું 1° કરતાં વધારે કોણો પ્રકિર્ણન થાય છે.

- (A) 10%
- (B) 90%
- (C) 2.62%
- (D) 0.14%

13) હાઈડ્રોજન પરમાણુના ત્રીજુ અને બીજુ કક્ષાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર

૨૬ ક

- (A) $\frac{2}{3}$
- (B) $\frac{4}{9}$
- (C) $\frac{3}{2}$
- (D) $\frac{9}{4}$

$$\frac{R_3}{R_2} = \frac{4}{1}$$

14) હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનની સ્થિતિઊર્જા eV.

- (A) -3.4
- (B) -6.8
- (C) -10.2
- (D) -13.6

15) એક પરમાણુમાં 2.3 eV તદ્દાવત બે ઊર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિભન્સ્તર પર સંકાંતિ કરે ત્યારે ઉત્તેજીત વિકિરણની આવૃત્તિ કેટલી થશે? [$h = 6.63 \times 10^{-34} \text{ Js}$]

- (A) $1.2 \times 10^{14} \text{ Hz}$
- (B) $5.6 \times 10^{14} \text{ Hz}$
- (C) $3.8 \times 10^{14} \text{ Hz}$
- (D) $1.6 \times 10^6 \text{ Hz}$


$$\begin{aligned} R &= 2.3 \\ f &= ? \\ r &f = ? \\ @ &5 \\ &5.5 \end{aligned}$$

16) કલોરીનને 34.98 માંને 36.98 માંનના બે સમસ્થાનિકો છે. આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ અનુકૂળે _____ અને _____ ટકા છે. કલોરીન પરમાણુનું સરેરાશ મળ 35.47 માંને છે.

- (A) 24.6, 75.4
- (B) 70.5, 29.5
- (C) 26.4, 73.6
- (D) 75.4, 24.6

$$\begin{aligned} &8.6 + \\ &@ 24.6 \\ &9.23 \\ &26.3 \end{aligned}$$

17) નીચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરો.



92

(A) ${}_{56}^{144} Ba, 3 {}_0^1 n$

(B) ${}_{54}^{140} Xe, 2 {}_0^1 n$

(C) ${}_{51}^{133} Sb, 4 {}_0^1 n$

(D) ${}_{54}^{140} Xe, 3 {}_0^1 n$

18) ${}_1^3 H$ અને ${}_2^3 He$ ન્યૂક્લિયર _____ છે.

(A) સમસ્થાનિક (Isotopes)

(B) સમદળીય (Isobar)

(C) આઈસોટોન (Isotones)

(D) સમઘટક (Isomer)

19) ન્યૂક્લિયસની ધનતા પરમાળું દળાંક (A) વધે તેમ _____.

(A) વધે છે.

(B) અચળ રહે છે.

(C) ઘટે છે.

(D) હલકા તત્વો માટે ઘટે છે અને ભારે તત્વો માટે વધે છે.

20) ગોલ્ડના સમસ્થાનિક ${}_{79}^{197} Au$ અને સિલ્વરના સમસ્થાનિક ${}_{47}^{107} Ag$ ના ન્યૂક્લિયસની તિનિયાઓનો આશરે ગુણોત્તર કેટલો?

(A) 1.23

(B) 1.83

(C) 1.32

(D) 2.06

(1)
(1)

5.
5.

21) બધારે હજી જંગનને ફોર્માર્ક ભાગસ આપવામાં આવે, ત્યારે તે,

- (A) પોટેન્શિયલ બેરીયર (ની ઊંચાઈ) વધારે છે.
- (B) ખતુમતી વાહકોનો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે.
- (C) પોટેન્શિયલ બેરીયર (ની ઊંચાઈ) ઘટાડે છે.
- (D) ઉપરનામાંથી એકપણ નહીં.

22) કાર્બન, સિલિકોન અને જર્મનિયમ દરેકને ચાર વેલેન્સ ઈલેક્ટ્રોન હોય છે.
તેમને અનુકૂળ $(Eg)_c$, $(Eg)_{Si}$ અને $(Eg)_{Ge}$ જેટલા ઊર્જા બેન્ડ ગેપ વડે છુટા
પાડતા વેલેન્સ અને કન્ડક્ષન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી
કૃચું વિધાન સત્ય છે?

- (A) $(Eg)_{Si} < (Eg)_{Ge} < (Eg)_c$
- (B) $(Eg)_c > (Eg)_{Si} > (Eg)_{Ge}$
- (C) $(Eg)_c < (Eg)_{Ge} > (Eg)_{Si}$
- (D) $(Eg)_c = (Eg)_{Si} = (Eg)_{Ge}$

23) ધાર્તુંઓની અધરોધકતાઓનો વિસ્તાર લગભગ _____ છે.

- (A) $10^{-2} - 10^{-8} \Omega m$
- (B) $10^{-5} - 10^6 \Omega m$
- (C) $10^2 - 10^8 \Omega m$
- (D) $10^{11} - 10^{19} \Omega m$

24) ઓરડાના વરસાને શુદ્ધ કિલિકોન (Si) માટે પ્રતિનિધિત્વ રૂપ (Forbidden Band) માણી રિસ્ક્રોનને કુદ્દો ભરણ માટે જરૂરી વિના કરાસર _____ છે.

- (A) 1.1 eV
- (B) 0.01 eV
- (C) 0.72 eV
- (D) 0.05 eV

25) ધરો કે શુદ્ધ Si સ્ફરિકમાં 5×10^{23} પરમાણુ m^{-3} છે. તેને 1 ppm અનુભાવ (સંદર્ભ) સાથે As વડે ડોષ કરવાનાં આવે છે રિસ્ક્રોનની સંખ્યા અનુભાવ _____ થાય (n_i = $1.5 \times 10^{16} \text{ m}^{-3}$ આપેવ છે)

- (A) $5 \times 10^{28} \text{ m}^{-3}$
- (B) $4.5 \times 10^9 \text{ m}^{-3}$
- (C) $5 \times 10^{16} \text{ m}^{-3}$
- (D) $5 \times 10^{22} \text{ m}^{-3}$

26) એક રિસ્ક્રોન $2 \times 10^4 \text{ N/C}$ ના ઉદ્દિશાના નિયમિત વિદુતક્ષેત્રમાં 2 cm વેટા અંતરનું પાતન પાણે છે. તો રિસ્ક્રોનનો પ્રવેગ _____ m/s^2 થાય.

$$[m_e = 9.11 \times 10^{-31} \text{ kg}]$$

- (A) 3.51×10^{15}
- (B) 3.51×10^{14}
- (C) 1.9×10^{15}
- (D) 2.9×10^{15}

27) એક સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 3 \times 10^3 i$ N/C નો વિચાર કરો. xy સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 cm ની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફલક્સ કેટલું હશે?

(A) $30 \text{ Nm}^2/\text{C}$

(B) શૂન્ય

(C) $15 \text{ Nm}^2/\text{C}$

(D) $60 \text{ Nm}^2/\text{C}$

28) જ્યારે વિદ્યુત ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ રોડ એ અસમાન વિદ્યુતક્ષેત્ર \vec{E} માં \vec{E} ને પ્રતિસમાંતર હોય ત્યારે

(A) ડાયપોલ પર કોઈ પરિણામી બળ લાગતું નથી.

(B) ડાયપોલ પર વધતી ક્ષેત્રની દિશામાં બળ લાગે છે.

(C) ડાયપોલ પર ઘટતી ક્ષેત્રની દિશામાં બળ લાગે છે.

(D) ડાયપોલ પર વિદ્યુતક્ષેત્રને લંબડુપે બળ લાગે છે.

29) સમધનની કોઈ એક સપાટીના ભદ્યબિંદુ પર q વિદ્યુતભારને મૂકવામાં આવે છે, તો સમધન સાથે સંકળાતું વિદ્યુત ફલક્સ _____.

(A) q/ϵ_0

(B) $q/6\epsilon_0$

(C) $q/2\epsilon_0$

(D) $q/4\epsilon_0$

30) $0.4 \mu C$ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજી $0.8 \mu C$ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે લાગમાં લાગતું સ્થિત વિદ્યુત બળ $0.2 N$ છે. તો એ વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું લશે?

- (A) $12 m$
- (B) $0.12 m$
- (C) $1.2 m$
- (D) $0.012 m$

31) જો કોઈ પહાર્થ n_1 પ્રોટોન અને n_2 ઈલેક્ટ્રોન ધરાવતો હોય તો, પહાર્થ પર વિદ્યુતભારનો કુલ જરૂરો _____ છે.

- (A) $(n_1 - n_2) e$
- (B) $n_1 n_2 e$
- (C) $(n_2 - n_1) e$
- (D) $(n_1 + n_2) e$

32) કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કચું છે.

- (A) $[M^1 L^2 T^4 A^{-2}]$
- (B) $[M^{-1} L^{-2} T^4 A^2]$
- (C) $[M^{-1} L^{-2} T^4 A^2]$
- (D) $[M^1 L^2 T^{-4} A^{-2}]$

33) કોઈ સુવાહક પર વિદ્યુતભાર મુકતાં સ્થાયી સ્થિતિમાં નીચેનામાંથી કઈ બાબત સારી નથી.

- (A) સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
- (B) સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુતક્ષેત્ર સપાટીને દરેક બિંદુંએ લંબ હોય છે.
- (C) સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહિ.
- (D) સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય છે.

34) $4 \times 10^{-7} \text{ C}$ વિદ્યુતભારથી 9 cm દૂર આવેલા બિનુંચે સ્થિતિમાન કેટલું થાય ?

- (A) $4 \times 10^4 \text{ V}$
(B) $4 \times 10^{-4} \text{ V}$
(C) $4 \times 10^5 \text{ V}$
(D) $4 \times 10^3 \text{ V}$

35) 900 pF ના એક કેપેસિટરને 100 V ની બેટરી વડે વિદ્યુતભારિત કરાય છે.

હવે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 pF ના વિદ્યુતભાર વિહિન કેપેસિટર સાથે જોડવામાં આવે છે, તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે.

- (A) $2.25 \times 10^{-6} \text{ J}$
(B) $1.125 \times 10^{-6} \text{ J}$
(C) $4.5 \times 10^{-6} \text{ J}$
(D) શૂન્ય

36) $2\mu\text{F}$, $3\mu\text{F}$ અને $4\mu\text{F}$ કેપેસિટન્સના ત્રણ કેપેસીટરોને સમાંતરમાં જોડેલ છે.


તો સંયોજનનું કુલ કેપેસીટન્સ કેટલું થાય ?

- (A) $\frac{13}{12}\mu\text{F}$
(B) $9\mu\text{F}$
(C) $\frac{12}{13}\mu\text{F}$
(D) $12\mu\text{F}$

37) નીચેનામાંથી કોણી અવરોધકતા તાપમાનના વધારા સાથે પઢતી જાય છે ?

- (A) ઘાતુઓ
(B) મિશ્ર ઘાતુઓ
(C) અર્ધવાહકો
(D) અવાહકો

38) નીચે આપેલ વિદ્યુત પરિપथ માટે બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તકષણ V_A - V_B = _____.



- (A) 3V
- (B) 6V
- (C) -3V
- (D) -6V

(ફક્ત દર્શિહીન વિદ્યાર્થીઓ માટે)

38) 10V જેટલું emf અને 3Ω જેટલો આંતરિક અવરોધ ઘરાવતી બેટરીને 17Ω ના અવરોધ સાથે જોડવામાં આવે છે. તો પરિપથમાં પ્રવાહ _____ થાય.

- (A) 0.5 A
- (B) 0.5 μA
- (C) 0.5 mA
- (D) 5 A

39) એક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% નો વધારો કરતાં તેના અવરોધમાં થતો વધારો _____.

- (A) 100%
- (B) 300%
- (C) 200%
- (D) 400%

40) અતિલાંબા I પ્રવાહ ધારિત તારની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તિપ્તિના _____ (તારની વિજયા 'r' છે.) ૨૬

(A) $\frac{\mu_0 I}{2r}$

(B) $\frac{\mu_0 NI}{\pi r}$

(C) $\frac{\mu_0 I}{2\pi r}$

(D) શૂન્ય

41) ચલિત ગુંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર કઈ ભૌતિકરાશિ મળે?

(A) વિધુત પ્રવાહ

(B) અવરોધ

(C) ઉર્જા

(D) બળ

42) એક ઇલેક્ટ્રોન $6 \times 10^{-11} \text{ T}$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 60° ના કોણે $3 \times 10^7 \text{ m/s}$ ના વેગાથી દાખલ થાય છે. તો તેના હેલીકલ ગતિપથનો પેચ (Pitch) કેટલો થશે?

$$(m_e = 9.1 \times 10^{-31} \text{ kg}, e = 1.6 \times 10^{-19} \text{ C})$$

(A) 0.12 cm

(B) 100 m

(C) 89.3 cm

(D) 20 m

$$B = 6$$

$$\theta =$$

$$v =$$

$$B = ?$$

43) 4cm અંતરે રહેતા, બે લંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8A અને 5A વિદ્યુતપ્રવાહો એક ૪ (સમાન) દિશામાં વહે છે. તાર A ના 20cm લંબાઈના વિભાગ પર લાગતું બળ કેટલું થાય?

- (A) $2 \times 10^{-5} \text{ N}$
- (B) $3 \times 10^{-5} \text{ N}$
- (C) $4 \times 10^{-5} \text{ N}$
- (D) $5 \times 10^{-5} \text{ N}$

44) ફેરોમેન્ટેટિક પદાર્થની પરમિઅબીલીટી (μ) અને શૂન્યાવકાશની પરમિઅબીલીટી (μ_0) વચ્ચેનો કયો સંબંધ સાચો છે.

- ~~(A)~~ $\mu < \mu_0$
- (B) $\mu \gg \mu_0$
- (C) $\mu > \mu_0$
- (D) $\mu + 1 < \mu_0$

45) આત્મપ્રેરકત્વનો કયો એકમ ઓટો છે?

- (A) JA^{-2}
- (B) WbA^{-1}
- ~~(C)~~ VsA^{-1}
- ~~(D)~~ Nm A^{-1}

46) પાસપાસે રહેત ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5H છે. જો એક ગૂંચળામાં 0.5sec માં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી 20A નો છે તો અન્ય ગૂંચળામાં પ્રેરિત emf _____ V.

- ~~(A)~~ 60
- (B) 20
- (C) 30
- (D) 10

47) જાહેરા 10cm લંબાઈના બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધૂવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક , નિયમાના બંધગાળાને સ્થિર રાહેલ છે. તો

25

$\lambda = 1$

V થશે.

(A) Bvl

(B) $10r$

(C) $\frac{\mu_0 I}{2r}$

(D) શૂન્ય

48) અતિલાંબા પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $2 \times 10^{-4} T$ છે. તો તેમાં એકમ કદ દીઠ સંગ્રહાતી ચુંબકીય ઊર્જા _____.

35

v =

2

(A) $3 \times 10^{-2} J m^{-3}$

(B) $9.1 \times 10^{-2} J m^{-3}$

(C) $1.6 \times 10^{-2} J m^{-3}$

(D) $5.8 \times 10^{-2} J m^{-3}$

49) માત્ર ઈન્ડક્ટર ધરાવતા A.C. પરિપथમાં ; એ V કરતાં

(A) કળામાં $\pi/2$ જેટલો પાછળ હોય છે.

(B) કળામાં π જેટલો આગળ હોય છે.

(C) કળામાં $\pi/2$ જેટલો આગળ હોય છે.

(D) કળામાં π જેટલો પાછળ હોય છે.

50) 220V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100W નું રેટિંગ ધરાવે છે. તો

બબ્લનો અવરોધ _____ Ω .

25 = 2

P = 2

~~25~~

9

(A) 242

(B) 222

(C) 484

(D) 311

054 (G)

(FEBRUARY-MARCH, 2025)

(SCIENCE STREAM)

(CLASS - XII)

(Part - B)

Time : 2 Hours]

[Maximum Marks : 50]

શુદ્ધનાચો :

- 1) સ્પર્ધ વંચાય તેવું હસ્તકેન જગતનું.
- 2) આ પ્રશ્નાના ભાગ - B માં નાચ વિભાગ છે. અને કુઝ 1 થી 27 પ્રશ્નો આપેલ છે.
- 3) બધા 9 પ્રશ્નો ફરજિયાત છે. અંતિમ વિકલ્પો આપેલ છે.
- 4) પ્રશ્નની જરૂરી બાજુના અંક તેણા ગુસ્સા છાવે છે.
- 5) નવો વિભાગ નવા પાના પર લખવો.
- 6) પ્રશ્નોના જવાબ ફરજાં લખવા.
- 7) વિદ્યાર્થીઓ જરૂર જસ્તા ત્યાં સાંચા કેલ્ક્યુલેટર અને લોગ ટેબલનો ઉપયોગ કરી શકો.
- 8) અકૃતિવાળા/ચાર્ટ પ્રશ્નોએ દર્શિયીન વિદ્યાર્થીઓ માટે અસા પ્રશ્નો આપેલ છે. જેનું ખાસ ધ્યાન રાખવું, આ પ્રશ્નો માત્ર દર્શિયીન વિદ્યાર્થીઓ માટે 9 છે.

વિભાગ - A

- નીચે આપેલ પ્રશ્ન નં. 1 થી 12 માંથી માત્રા મુજબ જરે તે 8 પ્રશ્નોના ઉત્તર દખાઓ.
(દ્વિક પ્રશ્નના 2 ગુણ)
- 1) વિદ્યુતક્ષેત્ર રેખાનોના ગુણવર્ણો લખો (કેર્લિંગ ચર.) [2]
 - 2) સમાન બાબ્ય વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ઇન્ફરોલની સ્થિતિઓનું સૂચ તરફે
(કેર્લ દર્શિયીન વિદ્યાર્થીઓ માટે) [2]
 - 2) બાબ્ય વિદ્યુતક્ષેત્રમાં બે વિદ્યુતભારેના તંત્રની સ્થિતિઓની સમજાવી તેણું સૂચ તરફે [2]
 - 3) પેટીનમ અવરોધ ધરાવતા થર્મોસ્ટિટ્રમાં રહેલા પેટીનમ તરસનો અવરોધ બસ્ફેના તાપમાને 5Ω અને
વરાળના તાપમાને 5.23Ω છે. જ્યારે થર્મોસ્ટિટ્રને Hot Bath માં દૂખાડવામાં આવે છે ત્યારે પેટીનમ
તરસનો અવરોધ 5.795Ω મળે છે. તો Bath નું તાપમાન ગણાયે [2]
 - 4) એક સોલેનોઇડમાં ગરભમાંના (કેર્લ) દ્રવ્યની સાપેક્ષ પરમિઅલીટી 400 છે. સોલેનોઇડના આંદો ગરભની
અવાહક વેળું જુદુ પાડેલા છે આંદોમાંથી 2A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક ચીર દીકે 1000
આંદો હોય, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને મેન્ડેન્ડિશનની ગજાતરી કરો. [2]
 - 5) 10cm ત્રિજ્યા, 500 આંદોઓ અને 2Ω અવરોધ ધરાવતા એક ગોળાકાર ગ્રૂપણને તેણું સમાતાન
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહેતે રીતે મૂકવામાં આવે છે. તેણે 0.5 માં તેણા
ઉદ્ભવાસને અનુલક્ષીને 180° અભિનાન કરાવવામાં આવે છે. આ ગ્રૂપણામાં પ્રેરિત emf અને વિદ્યુતપ્રવાહનું
માન શોધો. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3 \times 10^{-5} T$ છે. [2]
 - 6) વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં અલ્પમાત્રામાં ઉર્જાનો વ્યય કરી કરી રીતે થાય છે તે જણાવો. [2]

- (7) એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનાં જ્યાવર્તી દોલનુંની આવૃત્તિ $2 \times 10^6 \text{ Hz}$ અને કંપવિસ્તાર 39 V/m છે.
- તરંગની તરંગલંબાઈ કેટલી છે?
 - દોલન કરતા ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો છે?
- 8) હાઇનોન્સના સિદ્ધાંતની મદ્દથી સમતલ પરાવર્તક સપારી પરથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો. [2]
- (ફક્ત દાખિલાન વિદ્યાર્થીઓ માટે)
- 8) બે સુસમ્ભાદ્ર ઉદગમોમાંથી ઉત્સર્વજીતા તરંગોના સ્થાનાંતરો વચ્ચેનો કળા તફાવત છે. તો કોઈ બિન્દુએ સંપાત થતા પરિણામી તરંગની તિપ્રતાનું સૂત્ર મેળવો. [2]
- 9) a) $5.4 \times 10^6 \text{ m/s}$ ની ઝડપથી ગતિ કરતા ઈલેક્ટ્રોન અને
b) 30 m/s ની ઝડપથી ગતિ કરતા 150g ના બોલ, સાથે સંકળાયેલ ડિ-બોલ્સી તરંગલંબાઈ કેટલી હશે? [2]
- 10) બોલના પરમાણું મોડેલની કોઈપણ બે સ્વિકૃતિઓ જણાવો. [2]
- 11) સૂર્યમાં થતી પ્રોટોન-પ્રોટોન ચક્ક પ્રક્રિયાના સમીકરણો ઉર્જના મૂલ્યો સહિત લખો. [2]
- 12) P-પ્રકારના અર્ધવાહક પર નોંધ લખો. [2]
- (ફક્ત દાખિલાન વિદ્યાર્થીઓ માટે)
- 12) N-પ્રકાર અને P-પ્રકારના અર્ધવાહકો વચ્ચેના તફાવતના બે-બે મુદ્દાઓ જણાવો. [2]

વિભાગ - B

- નીચે આપેલ પ્રશ્ન નં. 13 થી 21 માંથી માણ્યા પ્રમાણો ગમે તે 6 પ્રશ્નોના ઉત્તર લખો.
(દરેક પ્રશ્નના 3 ગુણ) [18]
- 13) સમાંતર પ્લેટ કેપેસીટરના કેપેસીટન્સનું સૂત્ર મેળવો. [3]
- (ફક્ત દાખિલાન વિદ્યાર્થીઓ માટે)
- 13) કેપેસીટરની બે સેટો વચ્ચેના વિસ્તારને ડાય ઈલેક્ટ્રોક્લિથી પુરેપુરુ ભરતાં તેના કેપેસીટન્સ પર ડાય ઈલેક્ટ્રોક્લિની અસર ચર્ચો. [3]
- 14) એ, અને E_2 emf વાળા તથા r_1 અને r_2 આંતરિક અવરોધ ઘરાવતા બે વિદ્યુતકોષોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય emf અને સમતુલ્ય આંતરિક અવરોધનાં સૂત્રો મેળવો. [3]
- 15) એક વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ 10 Am^2 છે. ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે. કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત બનાણ કરી શકે. $2T$ જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તો છે કે જેથી શક્યાતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં (એક રેખસ્થ) હોય. ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળનું 90° કોણ જેટલું બ્રમજા કરે છે.
- ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટેકના મૂલ્યો કેટલા હશે?
 - જ્યારે ગૂંચળનું 90° પાસે પહોંચે ત્યારે તેણે કોણીય ઝડપ માપા કરી હશે? ગૂંચળાની ઝડતની ચાકમાત્રા 0.1 kg m^2 છે.

- 16) AC જનરેટરની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવી તેમાં પ્રેરિત emf નું સૂત્ર મેળવો. [3]

(ફક્ત દાખિલી વિદ્યાર્થીઓ માટે)

- 16) આત્મપ્રેરણ એટલે શું? આત્મપ્રેરિત emf નું સૂત્ર મેળવો. તેને Back emf તરફ કેમ ઓળખવામાં આવે છે? [3]

- 17) બહલી શકાય તેવી આવૃત્તિવાળો 230V ac સ્ત્રોત LCR શ્રેણી પરિપથ સાથે જોડેલ છે. $L = 5H, C = 80\mu F$ અને $R = 40\Omega$ છે. $f = 49.76$ [3]

- a) પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્વોતની આવૃત્તિ નક્કી કરો. $2 = \frac{52 \times 10^3}{5 + 0.12}$
 $b) \text{ અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઈમ્પિડન્સ અને પ્રવાહનો કંપવિસ્તાર શોધો. } \\ c) \text{ પરિપથનાં ત્રણોય ઘટકોનાં બે છેડા વચ્ચેનો rms વૉલ્ટેજ (સ્થિતિમાન તફાવત) શોધો. }$

- 18) જરૂરી આકૃતિઓ દોરી પાતળા બહિંગોળ લેન્સ માટે લેન્સમેકરનું સમીકરણ મેળવો. [3]

(ફક્ત દાખિલી વિદ્યાર્થીઓ માટે)

- 18) એક ટાંકીને 12.5cm ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોથની આભાસી ઊંડાઈ માઈક્રોસ્કોપ વડે માપતાં 9.4cm મળે છે. પાણીનો વક્કિભવનાંક કેટલો હશે? જો 1.63 વક્કિભવનાંક ધરાવતાં પ્રવાહીને પાણીના બહલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે, તો સોથ પર ફરીથી માઈક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડે? [3]

- 19) ગ જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં, પડા પરના જે બિંદુએ પથ તફાવત ગ જેટલો થાય ત્યાં તીવ્રતા K એકમ છે. જ્યાં પથ તફાવત $\lambda/3$ થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? [3]

- 20) ફોટોન એટલે શું? ફોટોનના ગુણધર્મો લખો. [3]

- 21) પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઈડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છુટા પાડવા માટે 13.6 eV ઊર્જાની જરૂર છે. હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. [3]


વિભાગ - C

- નીચે આપેલ પ્રશ્ન નં. 22 થી 27 માંથી માઝ્યા મુજબ ગમે તે 4 પ્રશ્નોના ઉત્તર આપો. (દરેક પ્રશ્નના 4 ગુણા)

- 22) a) ઉન સાથે ધસેલા એક પોલીથીન ટુકડા પર $3 \times 10^{-7} C$ ઋણ વિદ્યુતભાર છે.
i) સ્થાનાંતરીત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે?
ii) ઉનથી પોલીથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે?
b) i) કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B નાં કેન્દ્રો વચ્ચેનું અંતર 50cm છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7} C$ હોય, તો તેમની વચ્ચે લાગતું અપાક્ષી બળનું મૂલ્ય કેટલું હશે? A અને B વચ્ચેના અંતરની સરખામળીએ તેમની ત્રિજ્યાઓ અવગાળી શકાય તેવી છે.
ii) જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાક્ષી બળ લાગશે?

[4]

23) આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો.



(ફક્ત દાખાવી માટે)

- 23) 1.5A પ્રવાહનું વહેન કરતાં 3m લાંબા અને $1.0 \times 10^{-7} m^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહેન પામતા ઈલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણું લગભગ એક વાહક ઈલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા $9 \times 10^3 \text{ kg/m}^3$ અને તેનો પરમાણું દળાંક 63.5 પાં છે. આવા ઈલેક્ટ્રોનને તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે?

[4]

- 24) માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથ માટે વિદ્યુતપ્રવાહનું સૂત્ર મેળવી તે પરથી તેમાં સરેરાશ પાવર શોધો.

[4]

- 25) એક અંતર્ગોળ અરીસાની વક્તાત્રિજ્યા 15cm છે. આ અરીસાની સામે વસ્તુને (i) 10cm (ii) 5cm દૂર મૂકું રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી દરેક કિસ્સામાં મેળવો.

[4]

- 26) $^{239}_{94}\text{Pu}$ ના વિખંડન ગુણધર્મો $^{235}_{92}\text{U}$ ના જેવાં છે. વિખંડન દીઠ વિમુક્ત થતી સરેરાશ ઉજ્જ 180 MeV છે. જો શુદ્ધ $^{239}_{94}\text{Pu}$ ના 1 kg માંના બધા પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉજ્જ MeV માં વિમુક્ત થશે?

[4]

- 27) અર્ધતરંગ રેકિટિફિયરનો યોધ્ય વીજ પરિપથ દોરી સમજાવો. અને તેના વડે ઈનપુટ AC અને આઉટપુટ વોલ્ટેજના તરંગ સ્વરૂપો દર્શાવો.

[4]

(ફક્ત દાખાવી માટે)

- 27) p-n જંક્શન ડાયોડના ફોરવર્ડ બાયસ અને રીવર્સ બાયસ વચ્ચે તફાવતના મુદ્દાઓ જણાવો.
(ચાર-ચાર મુદ્દાઓ)

[4]

